



**RUSHIL**

DECOR LIMITED

WE'LL MAKE IT

**RDL/054/2023-24**

**Date: 01.09.2023**

To,  
**National Stock Exchange of India Ltd.**  
**Exchange Plaza,**  
**Bandra – Kurla Complex,**  
**Bandra (E), Mumbai – 400 051**  
**NSE EQUITY SYMBOL: RUSHIL**

To,  
**BSE Limited**  
**Phiroze Jeejeebhoy Towers,**  
**Dalal Street,**  
**Mumbai- 400 001**  
**BSE SCRIP CODE: 533470**

**ISIN: INE573K01017**

Dear Sir/Madam,

**Ref: Regulation 47(1) of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations")**

**Sub: Intimation of publication of newspaper advertisements in respect of 29th Annual General Meeting of the Company to be held through Video Conferencing / Other Audio Visual Means**

With reference to the above captioned subject, please find enclosed newspaper advertisements published in Business Standard (English) and Jai Hind (Gujarati) newspaper on today i.e. Friday, 1st September, 2023, intimating that the 29th Annual General Meeting of the Company will be held on Monday, 25th September, 2023 at 11:15 A.M **through Video Conferencing / Other Audio Visual Means** in compliance with General Circular No. 20/2020 dated May 05, 2020 read together with other relevant circulars issued by MCA in this regard and Circular No. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated January 05, 2023 issued by the Securities and Exchange Board of India (SEBI).

The above information will also be available on the website of the Company at [www.rushil.com](http://www.rushil.com).

This is for your information and record.

Thanking You,

Yours Faithfully

**For Rushil Decor Limited**

**Hasmukh K. Modi**  
**Company Secretary**

**Encl.: a/a**



RUSHIL DÉCOR LTD., RUSHIL HOUSE, NEAR NEELKANTH GREEN BUNGALOW,  
OFF SINDHU BHAVAN ROAD, SHILAJ, AHMEDABAD-380058, GUJARAT, INDIA.

REGD. OFFICE: S. NO. 125, NEAR KALYANPURA PATIA, VILLAGE ITLA, GANDHINAGAR-MANSA ROAD,  
TA. KALOL, DIST. GANDHINAGAR-382845, GUJARAT, INDIA. | CIN: L25209GJ1993PLC019532

PH: +91-79-61400400 | FAX: +91-79-61400401 | EMAIL: INFO@RUSHIL.COM | WWW.RUSHIL.COM

**OSBI STATE BANK OF INDIA**  
 RANDHEJA BRANCH, DIST-GANDHINAGAR, GUJARAT-382610

**POSSESSION NOTICE**  
 [See Rule 8(1)] [For Immovable Property]

Whereas: The undersigned being the Authorised Officer of **State Bank Of India, Randheja Branch Dist- Gandhinagar, Gujarat-382610** under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated: **15/02/2022** calling upon the borrower **BHAVANJI NENAJI VAGHELA & KRISHNASINH VAGHELA (OWNER & GUARANTER)** to repay the amount mentioned in the notice being **Rs.19,82,000/- (Rupees Nineteen lakhs eighty two thousand rupees)** plus future interest thereon & other bank & incidental charges thereon within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notices hereby given to the borrower, legal heirs (known-unknown), legal representatives (known-unknown), guarantor and the public in general that the undersigned has taken **PHYSICAL POSSESSION** of the property described herein below in exercise of powers conferred on me under Section 13(4) of the said [Act] read with Rule 3 of the said rules on this **26th day of Month 08 of the year 2023**

The borrower, legal heirs (known-unknown), legal representatives (known-unknown), guarantor and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to charge of **State Bank of India, Randheja Branch Dist- Gandhinagar, Gujarat-382610** for an amount of **Rs.19,82,000/- (Rupees Nineteen lakhs eighty two thousand rupees)** plus future interest thereon & other bank & incidental charges thereon.

**The borrower's attention is invited to provision of Sub-Sub-section (8) of section 13 of the Act, in respect of the time available, to redeem the secured assets.**

**DESCRIPTIONS OF EQUITABLE MORTGAGE OF IMMOVABLE PROPERTIES**

Equitable Mortgage of the piece or parcel of the immovable property bearing Shop no-29, admeasuring 33.80 sq.mtrs. and shop no 30 admeasuring 16.15 sq mtrs. on Second Floor having Built Up Area admeasuring about 69.37 sq mtrs. undivided share in the land admeasuring in Scheme known as "Ashwamegh Complex" on the freehold Non Agriculture Commercial Use Land Bearing New Block No-476 paiki, situated, lying and being at Mouje Chiloda (Dabhoda), Taluka and District GANDHINAGAR. **BOUNDRIES : SHOP NO- 29 - EAST: Open Terrace, WEST: Road, NORTH: Road, SOUTH: Stair Case and Shop No. 30. SHOP NO-30 - EAST: Road, WEST: Road, NORTH: Stair case and Shop No 29, SOUTH: Shop No 31**

Date : 01-09-2023 Authorized Officer  
 Place : Randheja STATE BANK OF INDIA, RANDHEJA GANDHINAGAR

**RBL BANK LTD.**  
 REGISTERED OFFICE: 1st Lane, Shahupuri, Kolhapur-416001  
 National Office : 9th Floor, Techniplex-I, Off Veer Savarkar Flyover, Goregaon (West), Mumbai - 400 062.

**POSSESSION NOTICE**  
 (For Immovable Property) Rule 8(1)

Whereas the undersigned being the Authorized Officer of the **RBL BANK LTD** under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice dated **03/11/2022** calling upon the borrowers **Mr. Balvanthai Premjibhai Rangapadiya (Applicant), Mrs. Kailashben Balvanthai Rangapadiya (Co-Applicant), Mr. Brijesh Pranjivanbhai Serasiya (Co-Applicant)** in Loan Account Nos. **809001806891 and 809002777961** to repay the amount **Rs.31,34,453.20/-** mentioned in the notice dated **03/11/2022**, within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken **Actual Physical Possession** of the property described herein below in exercise of powers conferred on him under section 13(4) of the said Act read with Rule 9 of the said Rules on this date **27/08/2023**.

The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of **RBL BANK LTD** for an above mentioned amount and interest thereon.

**Description of the Immovable Property**

**Property Owned by - Mr. Balvanthai Premjibhai Rangapadiya** Residential property bearing flat no. 303 on 3rd floor, admeasuring built up area 91.24 sq. Mtrs in the building known as "Shri Hari: Apartment, situated at Survey no. 164, on plot no.34 & 51, Mouje: Mahendranagar, Morbi-363642, **Bounded and surrounded by:-** Towards East- 12.19 mtrs wide Road, Toward South-Plot No.51 Paiky's Road, Towards West- Plot No.50 & 35, Towards North - Flat No. 301 and 302.

Your attention is invited to provisions of section 13(8) of SARFAESI Act for redemption of secured assets i.e. property mentioned hereinbefore by tendering the aforementioned outstanding dues together with all costs, charges and expenses incurred by our bank.

Place: Morbi For RBL BANK LTD  
 Date: 27-08-2023 Authorized Officer  
 Mr. Abhay Nikam

**OSBI STATE BANK OF INDIA**  
 RANDHEJA BRANCH, DIST-GANDHINAGAR, GUJARAT-382610

**POSSESSION NOTICE**  
 [See Rule 8(1)] [For Immovable Property]

Whereas: The undersigned being the Authorised Officer of **State Bank Of India, Randheja Branch Dist-Gandhinagar, Gujarat-382610** under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated: **15/02/2022** calling upon the borrower **KRUSHNASINH BHAVANJI VAGHELA** to repay the amount mentioned in the notice being **Rs.15,16,005/- (Rupees Fifteen Lakhs Sixteen Thousand and five rupees only)** plus future interest thereon & other bank & incidental charges thereon within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notices hereby given to the borrower, legal heirs (known-unknown), legal representatives (known-unknown), guarantor and the public in general that the undersigned has taken **PHYSICAL POSSESSION** of the property described herein below in exercise of powers conferred on me under Section 13(4) of the said [Act] read with Rule 3 of the said rules on this **26th day of Month 08 of the year 2023**

The borrower, legal heirs (known-unknown), legal representatives (known-unknown), guarantor and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to charge of **State Bank of India, Randheja Branch Dist- Gandhinagar, Gujarat-382610** for an amount of **Rs.15,16,005/- (Rupees Fifteen Lakhs Sixteen Thousand and five rupees only)** plus future interest thereon & other bank & incidental charges thereon.

**The borrower's attention is invited to provision of Sub-Sub-section (8) of section 13 of the Act, in respect of the time available, to redeem the secured assets.**

**DESCRIPTIONS OF EQUITABLE MORTGAGE OF IMMOVABLE PROPERTIES**

Equitable Mortgage of the piece or parcel of the immovable property bearing Shop no-31, admeasuring 16.15 sq.mtrs. and shop no 32 admeasuring 16.15 sq mtrs. on Second Floor having Built Up Area admeasuring about 51.69 sq mtrs. undivided share in the land admeasuring in Scheme known as "Ashwamegh Complex" on the freehold Non Agriculture Commercial Use Land Bearing New Block No-476 paiki, situated, lying and being at Mouje Chiloda (Dabhoda), Taluka and District GANDHINAGAR. **SHOP NO-31 - EAST: Open Road, WEST: Road, NORTH: Shop No 30, SOUTH: Shop No 32, SHOP NO- 32 - EAST: Open Road, WEST: Road, NORTH: Shop No 31, SOUTH: Shop No 33**

Date : 01-09-2023 Authorized Officer  
 Place : Randheja STATE BANK OF INDIA, RANDHEJA GANDHINAGAR

**OSBI STATE BANK OF INDIA**  
 RANDHEJA BRANCH, DIST-GANDHINAGAR, GUJARAT-382610

**POSSESSION NOTICE**  
 [See Rule 8(1)] [For Immovable Property]

Whereas: The undersigned being the Authorised Officer of **State Bank Of India, Randheja Branch Dist-Gandhinagar, Gujarat-382610** under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated: **15/02/2022** calling upon the borrower **HINABEN KRUSHNASINH VAGHELA & KRISHNASINH VAGHELA (OWNER & GUARANTER)** to repay the amount mentioned in the notice being **Rs.13,82,620/- (Rupees Thirteen lakhs eighty two thousand six hundred twenty rupees only)** plus future interest thereon & other bank & incidental charges thereon within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notices hereby given to the borrower, legal heirs (known-unknown), legal representatives (known-unknown), guarantor and the public in general that the undersigned has taken **PHYSICAL POSSESSION** of the property described herein below in exercise of powers conferred on me under Section 13(4) of the said [Act] read with Rule 3 of the said rules on this **26th day of Month 08 of the year 2023**

The borrower, legal heirs (known-unknown), legal representatives (known-unknown), guarantor and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to charge of **State Bank of India, Randheja Branch Dist-Gandhinagar, Gujarat-382610** for an amount of **Rs.13,82,620/- (Rupees Thirteen lakhs eighty two thousand six hundred twenty rupees only)** plus future interest thereon & other bank & incidental charges thereon.

**The borrower's attention is invited to provision of Sub-Sub-section (8) of section 13 of the Act, in respect of the time available, to redeem the secured assets.**

**DESCRIPTIONS OF EQUITABLE MORTGAGE OF IMMOVABLE PROPERTIES**

Equitable Mortgage of the piece or parcel of the immovable property bearing Shop no-33, admeasuring 16.15 sq.mtrs. and shop no 34 admeasuring 16.15 sq mtrs. on Second Floor having Built Up Area admeasuring about 51.69 sq mtrs. undivided share in the land admeasuring in Scheme known as "Ashwamegh Complex" on the freehold Non Agriculture Commercial Use Land Bearing New Block No-476 paiki, situated, lying and being at Mouje Chiloda (Dabhoda), Taluka and District GANDHINAGAR. **BOUNDRIES: SHOP NO- 33, EAST: Road, WEST: Road, NORTH: Shop No 32, SOUTH: Shop No 34. SHOP NO- 34 - EAST: Road, WEST : Road, NORTH: Shop No 33, SOUTH: Shop No 35**

Date : 01-09-2023 Authorized Officer  
 Place : Randheja STATE BANK OF INDIA, RANDHEJA GANDHINAGAR

**Bank of Baroda**  
 Old Civil Court Branch, Anand  
 Dist. Anand.

**POSSESSION NOTICE**  
 (IMMOVABLE PROPERTY)

Whereas The undersigned being the Authorized Officer of the **BANK OF BARODA** under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice dated **19.04.2023** calling upon the borrower **M/s. Sankalp Industries, Proprietor Mr. Brijeshkumar Mafatbhai Valand & guarantors Mr. Mafatbhai Manibhai Valand, Mr. Kantibhai Manibhai Valand, Mrs. Kashmiri Brijeshkumar Valand, Mrs. Lalitaben Kantibhai Valand** to repay the amount mentioned in the notice being **Rs. 52,24,533.16/- (Rupees Fifty Two lakhs Twenty Four Thousand Five Hundred Thirty three Rupees and Sixteen Paise Only)** and interest thereon w.e.f. 01.03.2023 within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this the **28th day of August of the year 2023**.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of **Bank of Baroda, Old Civil Court Road, Branch, Anand** for an amount of **Rs. 52,24,533.16/- (Rupees Fifty Two lakhs Twenty Four Thousand Five Hundred Thirty three Rupees and Sixteen Paise Only)** and interest thereon.

**Description of the Immovable Property**

All that part and parcel of the property consisting of Industrial shop Mill, land and building known as "Sankalp Industries" constructed on the non-agricultural land bearing R.S. No. 404, total admeasuring area H. 1-06-23 ARE. Paiki H. 0-53-11 ARE. Paiki 1496.88 s.m. together with construction thereon, within limits of Village Samarkha, Ta. & Dist. Anand in the name of (1) **VALAND MAFATBHAI MANIBHAI**, (2) **VALAND KANTIBHAI MANIBHAI**, & (3) **VALAND LALITABEN D/o MANIBHAI**

The said property is bounded as under :  
 East : R.S. no. 403  
 West : 9.00 mtrs wide approach road  
 North : R.S. No. 402  
 South : Remaining portion of the said land

Date : 28-08-2023  
 Place : Anand  
 Authorised officer  
 Bank of Baroda

**Zenith Healthcare Ltd.**  
 Regd. Office : 504, Iscon Elegance, Nr. Anandham Jain Derasar, Prahladnagar Cross Road, S.G. Road, Ahmedabad-380015, Gujarat  
 Phone No. : +91-79-66168889 CIN : L2431GU1994PLC023574  
 Email : mahendrazenith@hotmail.com Website : www.zenithhealthcare.com

**NOTICE TO MEMBERS OF 29TH ANNUAL GENERAL MEETING OF SHAREHOLDERS**

Notice is hereby given that the **29th Annual General Meeting (AGM)** of the Company will be held on **Tuesday, 26th September, 2023 at 10:30 A.M.** via Video Conferencing ("VC") / other Audio visual Means ("OAVM") in compliance with the provision of the Companies Act, 2013 read with General Circular Nos. 14/2020, 17/2020, 20/2020, 02/2021, 21/2022, 03/2022 and 10/2022 dated April 08, 2020, April 13, 2020, May 05, 2020, January 13, 2021, December 8, 2021, December 14, 2021, May 5, 2022 and December 28, 2022 respectively issued by the Ministry of Corporate Affairs ("MCA CIRCULARS") and circulars No. SEBI/HO/CFD/CMD/ICIR/P/2022/62 dated May 13, 2022 & Circular no. SEBI/HO/CFD/PDD-2/CIR/2023/4 dated January 5, 2023 issued by the Security and Exchange Board of India (SEBI) to transact the business as set out in the notice convening the AGM (Notice).

In addition, the above mentioned circular has granted relaxation to the companies, with respect to printing and dispatching of physical copies of Annual reports to the shareholders. Accordingly, Annual reports for F.Y. 2022-23 and notice of 29th Annual General Meeting (AGM) will be sent through only at E-mail addresses of the Shareholders whose E-mail address is registered with the Company / Registrar and Share Transfer Agent (RTA)/ Depository participant.

Pursuant to Section 91 of the Companies Act, 2013 and Regulation 42 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015, the Register of Members and Share Transfer books of the Company will remain closed from September 20, 2023 to September 26, 2023 (both days inclusive).

Pursuant to Section 91 of the Companies Act, 2013 and Regulation 44 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015 and amendment made thereto, Company is pleased to offer E-voting facilities to its shareholders to enable them to cast their vote by electronic means on all the resolutions as set forth in the said Notice. The details pursuant to provisions of the Companies Act, 2013 and the Rules framed thereunder are given below:

- The Business as set forth in the Notice for the AGM may be transacted by electronic means.
- Voting period begins on September 23, 2023 at 9.00 a.m. and ends on September 25, 2023 at 05.00 p.m.
- Cut-off date for determining the eligibility to vote by electronic means or at the AGM is September 19, 2023.
- Anyone, who acquire share after dispatching this notice and holding shares as of the cut-off date i.e. September 19, 2023 may obtain login id and password by sending request to evoting@nsdl.co.in or mahendrazenith@hotmail.com.
- Members may note that: (i) the remote e-voting module shall be disabled by NSDL at 5:00 p.m. on September 25, 2023 and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; (ii) Since the 29th AGM will be convened through video Conferencing (VC), the facility for voting through physical ballot paper will not be made available, however members may cast their vote through e-voting which will be made available at the time of the AGM (iii) the members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM through video Conferencing (VC) but shall not cast their vote again; (iv) a person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail facility of remote e-voting as well as e-voting at the time of AGM; and
- For the process and manner of remote e-voting, members may go through the instructions in the Notice convening the AGM and in case of any queries in case of any queries, you may refer to the Frequently Asked Questions (FAQs) for members and e-voting user manual formembers available at the Downloads sections of <https://www.evoting.nsdl.com> or contact NSDL at the following call on : 022 - 4886 7000 or 022 - 2499 700

Members who are holding shares in physical form whose email addresses are not registered with the Company can cast their vote through remote e-voting or through the e-voting at the time of the meeting in manner and by following the instructions as mentioned in the Notes section of the Notice dated August 31, 2023 convening the 29th AGM. Further, the said notice is also available on company's website at [www.zenithhealthcare.com](http://www.zenithhealthcare.com) and on stock exchange at [www.bseindia.com](http://www.bseindia.com)

Company has appointed Mr. Kamlesh M. Shah, Practicing Company Secretary (C.P.No.2072) as a scrutinizer for conducting Remote-voting and E-voting process at Annual General Meeting in a fair and transparent manner.

Members are advised to register / update their e-mail address with their DPs in case of shares held in electronic form and to the Company and / or its Registrar and Share Transfer Agent (RTA) in case of shares held in physical form for receiving all communications, including Annual Reports, Notices, Circulars etc. by email from the Company in future.

For, Zenith Healthcare Limited  
 s/- **Mihir Shah**  
 Place : Ahmedabad Company Secretary - ACS - A41922

**Bank of India**  
 University Road Branch : Fortune Square, Nr. Kotecha Chowk, University Road, Rajkot

**Ref. No. Date : 31.08.2023**

**Notice Under Sec. 13 (2) Sarfaesi Act**

**Mr. Hiteshbhai Ramjibhai Parsana**  
 Surbhi Residency, Block No. 69, Kotharia Road, Kotharia, Rajkot, Gujarat - 360 001.

Dear Sir,  
**Possession of the Securities charged to the Bank under Section 13 (4) of Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002.**

**A/c No. 312762610000011**

Please refer to demand notice issued under Section 13(2) of SARFAESI Act, 2002 demanding from you within 60 days a sum of **Rs. 5,81,997.98/- (Rupees Five Lakh Eighty One Thousand Nine Hundred Ninety Seven and Ninety Eight Paise Only)** along with interest in respect of various credit facilities allowed to you by University Road Branch.

Now, as specified in the notice we shall enforce the securities without the intervention of court taking recourse to one or more of the measures under chapter III of the above Act, including taking over the possession of the assets charged to the bank to realize the bank's dues.

The undersigned being the authorized officer of **BANK OF INDIA**, under the said act, in exercise of the powers conferred under section 13(12) of the said act hereby demand from you to hand over the possession of the secured assets to the undersigned **BEFORE 10.09.2023** Failing which the undersigned will take possession of Mortgaged Property on or after any date and time as mentioned below without any further notice

**Details of Secured Assets**

**Residential Property** situated at Kotharia R. S. No. 125 paiki 1, Plot No. 76 to 81, Sub Plot No. 76 to 81/3 paiki, West Side Land, Block No. 69, "Govardhan" Surbhi Residency, Nr. Hapaliya Park, off. Kotharia Road, Vill. : Kotharia, Tal. & Dist. : Rajkot - 360005 constructed on land adm 82.04 Sq. Mts., built up Area : 82.04 Sq. Mtr of Rajkot - 360005 thereon. **Bounded as Under : On the North by : 7.50 Mts Road, On the South by : S. No. 126. On the East by : Sub-Plot No. 76 to 81/3, On the West by : Sub-Plot No. 76 to 81/4.**

If any person contravenes or attempts to contravene or abets the contravention of the provisions of this ACT or of any rules made there under, he shall be punishable with imprisonment for a term which may extend to One Year or with fine or with both under section 29 of SARFAESI ACT (54 of 2002).

You are requested to contact the undersigned and make it convenient to remain present at the time of taking possession of the properties.

Date : 31.08.2023, Yours faithfully,  
 Time : 03:45 PM Mannik Praveen kumar  
 Place : Rajkot Authorized Officer, Bank of India

**RUSHIL DECOR LIMITED**  
 Regd. Office: S. No. 125, Near Kalyanpura Patia, Village Itla, Gandhinagar mansa Road, Ta. Kalol, Dist. Gandhinagar-382845, Gujarat, India.  
 Corporate Office: Rushil House, Near Neelkanth Green Bungalow, Off Sindhu Bhavan Road, Shilaj, Ahmedabad-380058, Gujarat, India.  
 Ph: +91-79-61400400 | Fax: +91-79-61400401  
 Email: ipo@rushil.com | Website: www.rushil.com  
 CIN: L25209GJ1993PLC019532

**NOTICE OF 29<sup>th</sup> (TWENTY NINTH) ANNUAL GENERAL MEETING OF THE COMPANY TO BE HELD THROUGH VIDEO CONFERRING ("VC") / OTHER AUDIO-VISUAL MEANS ("OAVM")**

Notice is hereby given that in compliance with General Circular No. 20/2020 dated May 05, 2020 and 10/2022, 11/2022 dated December 28, 2022 issued by Ministry of Corporate Affairs (MCA) read together with other relevant circulars issued by MCA in this regard and Circular No. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated January 05, 2023 issued by the Securities and Exchange Board of India (SEBI) (collectively referred to as "Circulars") and in compliance with all other applicable laws, the 29<sup>th</sup> Annual General Meeting ("AGM") of the members of **RUSHIL DECOR LIMITED** will be held at **11.15 A.M. on Monday, 25<sup>th</sup> day of September, 2023 through Video Conferencing (VC)/Other Audio Visual Means (OAVM)** to transact the businesses as set out in the Notice of AGM.

In accordance with the aforesaid Circulars, Notice of the AGM along with the Annual Report for the Financial Year 2022-23 will be sent only by electronic mode to those Members whose e-mail addresses are registered with the Company/Registrar and Transfer Agents (RTA)/Depository Participants. Members holding shares in dematerialized mode and whose e-mail address are not registered, are requested to register their e-mail addresses with their relevant Depository Participants. Members may note that the Notice of AGM and Annual Report for the Financial Year 2022-23 will also be available on the Company's website at [www.rushil.com](http://www.rushil.com), website of the Stock Exchanges i.e. BSE Limited at [www.bseindia.com](http://www.bseindia.com) and at National Stock Exchanges of India limited at [www.nseindia.com](http://www.nseindia.com) and the AGM Notice will also available on the website of NSDL (agency for providing the Remote e-voting facility) at <https://www.evoting.nsdl.com/> in due course. Members can attend and participate in the AGM through VC/OAVM facility only. The instructions for joining the AGM is provided in the Notice of AGM.

Pursuant to Provision of Section 91 of the Companies Act 2013 and Rule 10 of the Companies (Management and Administration) Rules 2014, the Register of Members and Share Transfer Books of the Company will remain close from **Saturday, 16<sup>th</sup> day of September, 2023 to Monday, 25<sup>th</sup> September, 2023** (both days inclusive) for the purpose of determining the entitlement of final dividend of ₹ 0.50 (fifty paise) per equity share of ₹ 10/- each (@5%) as recommended by the Board, for the financial year 2022-23 on the paid up equity share capital of the Company, if declared at the ensuing Annual General Meeting.

Members holding shares either in physical form or dematerialized form, as on cut-off date **Friday, 15<sup>th</sup> day of September, 2023** may cast their vote electronically on the business as set in the notice of AGM through electronic voting system of NSDL from a place other than venue of AGM (Remote e-voting).

The Remote e-voting shall commence on **Thursday, 21<sup>st</sup> day of September, 2023 (9:00 AM IST) and end on Sunday, 24<sup>th</sup> day of September, 2023 (5:00 PM IST)**.

Members will have an opportunity to cast their vote remotely on the business as set forth in the Notice of the AGM through electronic voting system. The manner of remote e-voting and e-voting during the AGM for members holding shares in dematerialized mode, physical mode and for shareholders who have not registered their email addresses are provided in the Notice to the members.

Members may please note that in terms of aforementioned Circulars, the Company will not be sending physical copies of AGM Notice and Annual Report to the Members.

For, Rushil Decor Limited  
 Sd/-  
**Hasmukh K. Modi**  
 Company Secretary

Date: 31.08.2023  
 Place: Ahmedabad

**RBL BANK LTD.**  
 REGISTERED OFFICE: 1st Lane, Shahupuri, Kolhapur-416001  
 National Office : 9th Floor, Techniplex-I, Off Veer Savarkar Flyover, Goregaon (West), Mumbai - 400 062.

**POSSESSION NOTICE**  
 (For Immovable Property) Rule 8(1)

Whereas, the undersigned being the Authorized Officer of **RBL BANK LTD.** under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13 (12) read with Rule 8 & 9 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated **14/12/2022** in respect of Loan A/c Nos. **809002874059 and 809001765624** calling upon the borrower/s borrowers **Mr. Nilesh Babubhai Chauhan (Applicant & Mortgagor), Mrs. Lakshmben Nileshbhai Chauhan (Co-Applicant)**, to repay the amount mentioned in the notice being **Rs.10,82,085/-** total outstanding amount due as on **14/12/2022** in the aforesaid Loan Account Nos. within **60 days** from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken the **Actual Physical Possession** of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 9 of the said rules on this date **27/08/2023**.

The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of **RBL BANK LTD** for an above mentioned amount and interest thereon.

**Description of the Immovable Property**

**Property Owned by - Mr. Nilesh Babubhai Chauhan**

**Property No.01 :** Commercial property bearing Shop No. 02, Ground Floor admeasuring 09.08 Sq. Mtrs. Near Mayur Society, National Highway No. B/A, constructed upon the land of Plot No. 1 of R. S. No. 69, Paiky of Village Trajpar, Taluka Morbi - 363 642, **Bounded and surrounded by:-** On or towards East - Shop No.01, On or towards South - Other Property, On or towards West - Shop No.03, On or towards North-Road.

**Property No.02 :** Commercial property bearing Shop No.03, Ground Floor admeasuring 18.02 Sq. Mtrs. Near Mayur Society, National Highway No. B/A, constructed upon the land of Plot No. 01 of R. S. No.69, Paiky of Village Trajpar, Taluka Morbi - 363 642, **Bounded and surrounded by:-** On or towards East - Shop No.02, On or towards South - Other Property, On or towards West - Shop No.04, On or towards North - Road.

Your attention is invited to provisions of section 13(8) of SARFAESI Act for redemption of secured assets i.e. property mentioned hereinbefore by tendering the aforementioned outstanding dues together with all costs, charges and expenses incurred by our bank.

Place: Morbi For RBL BANK LTD  
 Date: 27-08-2023 Authorized Officer  
 Mr. Abhay Nikam

**HDFC BANK**  
 HDFC Bank Ltd. : 1st Floor, Aakansha Building, 10-Vijay Plot Corner, Nr. Suryamukhi Hanuman Temple, Gondal Road, Rajkot -360001, Mob. 9427728700

**APPENDIX-IV POSSESSION NOTICE [See Rule 8(1)]**

Whereas, (FOR IMMOVABLE PROPERTY)

The undersigned being the Authorized Officer of the HDFC Bank Limited under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of Powers conferred under Section 13 read with the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice dated **22.08.2022** calling upon the Borrowers (1) **HIMMATLAL BHOLABHAI MANSATAR**, (2) **LATE KAILASGAURI HIMMATLAL MANSATAR**, **SINCE DECEASED, NOTICE TO BE SERVED THROUGH HIS LEGAL HEIRS (2.1) HIMMATLAL BHOLABHAI MANSATAR**, (2.2) **OTHER LEGAL HEIRS OF LATE KAILASGAURI HIMMATLAL MANSATAR** to repay the amount mentioned in the notice being **Rs. 7,92,022.62 (Rupees Seven Lakh Ninety Two Thousand Twenty Two and Sixty Two Paise Only)** as on **20/08/2022** in Loan against Property availed by you vide Secured Loan A/c No: **80254060** with further interest and expenses within 60 days from the date of notice/service of the said notice.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers and the public in general that the undersigned has taken **Physical Possession** of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on this **27th Day of August of the year 2023**.

The Borrowers/Mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **HDFC Bank Limited** for an amount of **Rs. 5,06,644.62/-** as on **27/08/2023** – **80254060** and interest & expenses thereon until the full payment.

**DESCRIPTION OF IMMOVABLE PROPERTY**

All the part & parcel of Immovable Property being Residential Property constructed on Plot No.25, Shrinathnagar, Street No 2, Near Sitaram Chowk, Bhavnagar and situated on the land admeasuring Square Meter 110-00 of Plot No.25, Shrinathnagar situated on the land of Revenue Survey No.53/1 Paikae of Village : Tarsamiya, District : Bhavnagar and bounded as Under: East: Plot No 24, West: Plot No 26, North : Others Property, South: Road.

Date : 27.08.2023, Place: Bhavnagar Sd/- Authorised Officer,  
 HDFC Bank Ltd.

**Bank of India**  
 University Road Branch : Fortune Square, Nr. Kotecha Chowk, University Road, Rajkot

**Ref. No. Date : 31.08.2023**

**Notice Under Sec. 13 (2) Sarfaesi Act**

**To, Mrs. Vandana Luckrajsinh Parmar Luckyrajsinh Ghansyamsinh Parmar**  
 Marry Gold Heights, Building C, Thirteen Floor, Flat No. C 1304, Opp. ADB Hotel, off 150ft. Ring Road, Dist. : Rajkot - 360001

Dear Sir,  
**Possession of the Securities charged to the Bank under Section 13 (4) of Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002.**

**A/c No. 31277510000391 & 312760210000117 & 311010110016993**

Please refer to demand notice issued under Section 13(2) of SARFAESI Act, 2002 demanding from you within 60 days a sum of **Rs. 15,40,260.12/- (Rupees Fifteen Lakh Forty Thousand Two Hundred Sixty and Twelve Paise Only)** along with interest in respect of various credit facilities allowed to you by University Road Branch.

Now, as specified in the notice we shall enforce the securities without the intervention of court taking recourse to one or more of the measures under chapter III of the above Act, including taking over the possession of the assets charged to the bank to realize the bank's dues.

The undersigned being the authorized officer of **BANK OF INDIA**, under the said act, in exercise of the powers conferred under section 13(12) of the said act hereby demand from you to hand over the possession of the secured assets to the undersigned **BEFORE 10.09.2023** Failing which the undersigned will take possession of Mortgaged Property on or after any date and time as mentioned below without any further notice

**Details of Secured Assets**

**Residential Property** situated at R. S. No. 616 paiki 5, CSW No. 18, C.A.No. 1944/1, 24, F.P.No. 8/1, Plot No. 1, Marry Gold Heights, Building C, Thirteen Floor, Flat No. C 1304, Opp. ADB Hotel, off 150ft. Ring Road, Dist. : Rajkot - 360001 in the state of Gujarat within the jurisdiction of the sub registrar Rajkot, thereon. **Bounded as Under : On the North by : Margin than Building D, On the South by : Stair, Passage than Flat No. C 1301, On the East by : Margin Than 80 Feet Road, On the West by : Flat No. C 1303.**

If any person contravenes or attempts to contravene or abets the contravention of the provisions of this ACT or of any rules made there under, he shall be punishable with imprisonment for a term which may extend to One Year or with fine or with both under section 29 of SARFAESI ACT (54 of 2002).

You are requested to contact the undersigned and make it convenient to remain present at the time of taking possession of the properties.

Date : 31.08.2023, Yours faithfully,  
 Time : 3:00 PM Mannik Praveen kumar  
 Place : Rajkot Authorized Officer, Bank of India

**RBL BANK LTD.**  
 REGISTERED OFFICE: 1st Lane, Shahupuri, Kolhapur-416001  
 National Office : 9th Floor, Techniplex-I, Off Veer Savarkar Flyover, Goregaon (West), Mumbai - 400 062.

**POSSESSION NOTICE**  
 (For Immovable Property) Rule 8(1)

Whereas, the undersigned being the Authorized Officer of **RBL BANK LTD.** under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13 (12) read with Rule 8 & 9 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated **14/12/2022** in respect of Loan A/c Nos. **809002874059 and 809001765624** calling upon the borrower/s borrowers **Mr. Nilesh Babubhai Chauhan (Applicant & Mortgagor), Mrs. Lakshmben Nileshbhai Chauhan (Co-Applicant)**, to repay the amount mentioned in the notice being **Rs.10,82,085/-** total outstanding amount due as on **14/12/2022** in the aforesaid Loan Account Nos. within **60 days** from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken the **Actual Physical Possession** of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 9 of the said rules on this date **27/08/2023**.

The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of **RBL BANK LTD** for an above mentioned amount and interest thereon.

**Description of the Immovable Property**

**Property Owned by - Mr. Nilesh Babubhai Chauhan**

**Property No.01 :** Commercial property bearing Shop No. 02, Ground Floor admeasuring 09.08 Sq. Mtrs. Near Mayur Society, National Highway No. B/A, constructed upon the land of Plot No. 1 of R. S. No. 69, Paiky of Village Trajpar, Taluka Morbi - 363 642, **Bounded and surrounded by:-** On or towards East - Shop No.01, On or towards South - Other Property, On or towards West - Shop No.03, On or towards North-Road.

**Property No.02 :** Commercial property bearing Shop No.03, Ground Floor admeasuring 18.02 Sq. Mtrs. Near Mayur Society, National Highway No. B/A, constructed upon the land of Plot No. 01 of R. S. No.69, Paiky

હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે

LPGના ભાવમાં ઘટાડા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે?

નવી દિલ્હી, તા. ૩૧ મોંઘવારીમાં રાહત આપતા કેન્દ્ર સરકારે સામાન્ય લોકો માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે. જ્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૪૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના વધી ગઈ છે. સિટીટ્રુપ ઈ.કે. અનુસાર, રોંધણ ગેસના ભાવમાં ઘટાડો કરવાના ભારતના પગલાથી કુળાવો ઘટી શકે છે અને કેટલાક મોટા તહેવારો અને મુખ્ય ચૂંટણીઓ પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ગેસના ભાવ ઘટાડવાના નિર્ણયથી કુળાવાના દરમાં ૩૦ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થઈ શકે છે. આ સિવાય સપ્ટેમ્બરમાં ટામેટાના ભાવમાં ઘટાડાથી મોંઘવારીનો વધારો ૬ ટકાથી નીચે

જવાનો છે. જુલાઈમાં કુળાવો ૧૫ મહિનાની ટોચે પહોંચ્યો હતો અને અધિકારીઓ છૂટક કિંમતો ઘટાડવા માટે સક્રિય પગલાં લઈ રહ્યા છે. ભારત સરકાર ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડો કરીને સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં, સરકારે ચોખા, ઘઉં, ડુંગળી અને અન્ય અનાજની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જેથી કરીને વધતી કિંમતોથી રાહત મળી શકે. આ વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત ઓછામાં ઓછા પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજવાની છે. આ પછી ૨૦૨૪ની શરૂઆતમાં રાષ્ટ્રીય ચૂંટણી યોજાશે. આવી સ્થિતિમાં, અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આ માટે સમયાંતરે તિજોરીમાંથી વધુ નાણાં ખર્ચવામાં આવી શકે છે. આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય કૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા હોવા છતાં, ગેસોલિન અને ડીઝલના પંપ ભાવ એક વર્ષથી વધુ

સમયથી યથાવત છે. તેમણે કહ્યું કે ઈંધણીની કિંમતમાં કોઈપણ ઘટાડો એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા દ્વારા કરી શકાય છે. અમેરિકામાં કૂડ ઓઈલના વપરાશનો આંકડો આવી ગયો છે. અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટિટ્યૂટ અનુસાર, ત્યાં કૂડની ઈન્વેન્ટરીમાંથી ૧૧.૪૮૬ મિલિયન બેરેલ કૂડ લેવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે માત્ર ૨.૪૮૬ મિલિયન બેરેલ કૂડ ખેંચાયા હતા. આ વર્ષે એપ્રિલથી અત્યાર સુધીમાં કૂડ ઈન્વેન્ટરીમાંથી ૪૪ મિલિયન બેરેલ કૂડ ઓઈલનો ચોખ્ખો ઉપાડ થયો છે. આ કારણે ગઈ કાલે સાંજે ૪:૧૬ વાગ્યે બ્રેન્ટ કૂડની કિંમત ૧.૨૮ ટકા વધીને ૮૫.૫૦ બેરેલ થઈ હતી. ગયા સપ્તાહની સરખામણીમાં આ બેરેલ દીઠ \$1.50 નો વધારો છે. મંગળવારે બજાર બંધ થવા પર, બેંચમાર્ક બ્રેન્ટ કૂડ પ્રતિ બેરેલ \$85.49 પર બંધ થયું. વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયટ અથવા WTI કૂડ પણ પ્રતિ બેરેલ \$81.16 પર ટ્રેડ થઈ રહ્યું હતું.



ભારતમાં યોજનાર આગામી મિસ વર્લ્ડ ૨૦૨૨-૨૦૨૩ માટે આવેલી મિસ વર્લ્ડ ૨૦૨૨ કેરોલિના બીવેલ્સકા અને મિરા વરડે ઈન્ડિયા સિની શેટી પૂણે સ્થિત આસુન હોસ્પિટલની ખાતે મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા ઉભા કરાયેલા નીઓનો ઈન્ટેન્સિવ કેર યુનિટ (એનઆઈસીયુ)ની મુલાકાત લઈ યુનિટના ડોક્ટરો સાથે પોઝ આપી રહી છે.

રેલવે મંત્રાલય ૫૦૮ રેલવે સ્ટેશનને ડેવલપ કરી રહી છે

પ્રયાગરાજના રેલવે સ્ટેશનના વિકાસમાં કુંભ પડકારજનક

નવી દિલ્હી, તા. ૩૧ રેલવે મંત્રાલય દેશભરમાં ૫૦૮ રેલવે સ્ટેશનને ડેવલપ કરી રહી છે. આ તમામ સ્ટેશનો ૨૭ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલા છે. મુસાફરોને ટ્રેન પકડવામાં મુશ્કેલી ન પડે અને તેમને વધુમાં વધુ સુવિધા મળે તે માટે રેલવે આ સ્ટેશનોને ડેવલપ કરી રહ્યું છે.

કામગીરી શરૂ થઈ ગઈ છે... જોકે આ દરમિયાન વર્ષ ૨૦૨૨માં કુંભ શરૂ થયો... દેશભરના કરોડો ભંડો અહીં કુંભ પર આવશે... ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા મુજબ ગત કુંભમાં ૨૪ કરોડ શ્રદ્ધાળુઓ આવ્યા હતા, તો આ વર્ષે બે ઘણા એટલે કે ૪૮ કરોડ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના છે. રેલવે મંત્રાલય અનુસાર કુંભના વર્ષ ૨૦૨૨-૨૩ માટે નો વાર્ષિક અહેવાલ સાથે એજએમની નોટિસ માત્ર તે સભ્યોને જ ઉલ્લેખિત કરવામાં આવશે... કંપનીના ઈ-મેઈલ સરનામું કંપની નોંધપત્ર (આરટીએ) / ડિપોઝિટરી સહભાગીઓ સાથે નોંધાયેલા છે. ઈમેલથી સહભાગીઓ સાથે તેમનો ઈ-મેઈલ સરનામું કંપની નોંધપત્ર (આરટીએ) / ડિપોઝિટરી સહભાગીઓ સાથે નોંધાયેલા છે. ઈમેલથી સહભાગીઓ સાથે તેમનો ઈ-મેઈલ સરનામું કંપની નોંધપત્ર (આરટીએ) / ડિપોઝિટરી સહભાગીઓ સાથે નોંધાયેલા છે.

ગત કુંભ મેળામાં ૨૪ કરોડ શ્રદ્ધાળુઓ આવ્યા હતા, આ વર્ષે બે ઘણા ૪૮ કરોડ શ્રદ્ધાળુ આવવાની સંભાવના છે

રેલવે મંત્રી અશ્વિની વેણવાના જણાવ્યા અનુસાર આમ તો તમામ સ્ટેશનો ડેવલપ કરવા પડકારજનક હોય છે... કારણ કે વર્તમાન સમયમાં તે સ્ટેશનો પર ટ્રેનું સંચાલન થતું હોય છે... કંટ્રોલ સિસ્ટમ હોય છે... જંકશન બોક્સ, કેબલ, ઓપ્ટીકલ ફાઈબર સંબંધિત ઉપકરણો પણ ધ્યાન રાખવું પડે છે... ત્યારે આ તમામ સમસ્યાઓમાં નડતર બન્યા વગર સ્ટેશનોને ડેવલપ કરવું પડકારજનક હોય છે... જો ડેવલપ થઈ રહેલા સ્ટેશન પર એક સાથે લાખોની ભીડ પહોંચે તો ખરેખર, સાઈથી મોટા પડકારનો પણ સામનો કરશે... આટલી મોટી સંખ્યામાં લોકોની ભીડને મેનેજ પણ કરવાનું હોય છે. અહીં વાત ઉત્તર પ્રદેશમાં આવેલા પ્રયાગરાજ રેલવે સ્ટેશનની થઈ રહી છે... આ સ્ટેશનનો પણ ડેવલપ કરવાની

રહેલા કોઈપણ સ્ટેશન પર એક સાથે લાખોની સંખ્યામાં ભીડ આવતી નથી, તેથી રેલવે મંત્રાલય પ્રયાગરાજ રેલવે સ્ટેશનના ડેવલપની કામગીરીને પડકારજનક કહી રહી છે... રૂબિલ ડેકોર લિમિટેડ, સર્વિસ/હસ્તગત કે. મોડી કંપની સેક્ટરેટરી

REQUIRED શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જે.કે. સરવૈયા બી.એસ.ડબલ્યુ. કોલેજ શ્રી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન સંત કવરામ સિંધી કેમ્પસ, હવેલી સામે, સરદારનગર, ભાવનગર

Bank of Baroda ઇ-હરાજી વેચાણ નોટિસ 'માઈલ સ્ટોન', ગ્રાઉન્ટ ક્લબ, ગુઈવ-ઈન-રોડ, ગ્રાઉન્ટ-ઈન-લિનેના પાસે, ઘવનેજ, અમદાવાદ-૩૮૦૦૫૪ ફોન:(૦૭૯) ૨૭૪૯૧૦૮૮, E mail : thltht@bankofbaroda.com

ગોર્ક ઓફ ડિસ્કન્ટની ચૂંટણીની નોટિસ આથી થી ભુજ મર્કટાઈલ કો-ઓ બેંક લી અમદાવાદ ના તમામ સભ્યસહકર્મીઓ ને આ જાહેર નોટિસથી જાણ કરવામાં આવે છે કે, થી મહત્તી સ્ટેટ કો-ઓપ. સોસાયટીઝ એક્ટ - ૨૦૦૨, ની કલમ ૪૫ તથા થી મહત્તી સ્ટેટ કો-ઓપ.સોસાયટીઝ એક્ટ ૨૦૦૨, ના કલમ ૧૯(૧), બેંકના પેટા કાયદા નં. ૩૦(બ) તથા બેંકીંગ રેગ્યુલેશન એક્ટની જોગવાઈઓ મુજબ બેંકના નિયમક મંડળની ૨૦૨૩ થી ૨૦૨૮ ના સમય ગણના માટે ૧૫ જગ્યાઓ માટે ચૂંટણી કરવાની થતી હોઈ નીચે મુજબ ચૂંટણી માટે નો સંબંધિત કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે. જેની નોંધ લેવી ચૂંટણી અન્ય અનામત સીટોની તથા અન્ય માહિતી બેંકની હેડ ઓફીસ તથા બ્રાન્ચોના નોટિસ બોર્ડ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.